



પોલીસ કમિશ્નરની કચેરી, સુરત શહેર.
પોલીસ ભવન, અઠવાલાઇનસ, સુરત શહેર-૩૯૫૦૦૧
વિશેષ શાખા, કચેરી ટેલીફોન-૦૨૬૧ ૨૨૪૧૧૧૦
કંટ્રોલ રૂમ ફેક્સ નં. ૦૨૬૧ ૨૨૪૧૩૦૪
e-mail : special.cp.sur@gmail.com



:-: ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪ના નં.૨) ની કલમ-૧૪૪

ક્રમાંક:એસ.બી./ ઇદ-એ-મિલાદ- /૧૯૫/૨૦૨૧

વંચાણે લીધા

(૧) ગૃહવિભાગ સચિવાલય ગાંધીનગર ક્રમાંક:વિ-૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨- B તા.૧૭/૧૦/૨૦૨૧

(૨) અત્રેની કચેરીના ક્રમાંક :એસ.બી./ ઇદ-એ-મિલાદ- /૧૯૩/૨૦૨૧

૧. રાજ્યમાં covid-19 ના સંક્રમણની બાબતને ધ્યાને લેતા રાજ્ય સરકાર દ્વારા ગૃહ વિભાગના તા. ૨૪/૦૯/૨૦૨૧ ના હુકમ ક્રમાંક: વિ-૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨- B થી સમગ્ર રાજ્યમાં કેટલાક નિયંત્રણો અમલમાં મુકવામાં આવેલ છે. જેની અવધી ગૃહ વિભાગના તા.૦૮/૧૦/૨૦૨૧ ના હુકમ ક્રમાંક:વિ-૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨- B થી તા.૧૦/૧૦/૨૦૨૧ ના સવારના ૦૬/૦૦ કલાક થી તા.૧૦/૧૧/૨૦૨૧ ના સવારના ૦૬/૦૦ કલાક સુધી લંબાવવામાં આવેલ છે. જ્યારે ગૃહ વિભાગના તા. ૨૪/૦૯/૨૦૨૧ ના હુકમ ક્રમાંક: વિ-૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨- A થી રાજ્યના ૦૮ મહાનગરોમાં રાત્રી કફ્યુ તથા કેટલાક નિયંત્રણો અમલમાં મુકવામાં આવેલ છે. જેની અવધી ગૃહ વિભાગના તા.૦૮/૧૦/૨૦૨૧ ના હુકમ ક્રમાંક:વિ-૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨ - A થી તા. ૧૦/૧૦/૨૦૨૧ ના સવારના .૦૬/૦૦ કલાકથી તા.૧૦/૧૧/૨૦૨૧ ના સવારના ૦૬/૦૦ સુધી લંબાવવામાં આવેલ છે.

૨. આ ઉપરાંત ગૃહ મંત્રાલય, ભારત સરકાર દ્વારા પણ તા.૨૮/૦૯/૨૦૨૧ ના હુકમથી આગામી તહેવારોને અનુલક્ષીને માર્ગદર્શક સુચનાઓ આપેલ છે.

૩. તા. ૧૯/૧૦/૨૦૨૧ના રોજ ઇદ-મિલાદુન્ની સલલ્લાહુ અલયહે વઆલેહી વસલ્લમ (ઇદ-એ-મિલાદ) ના તહેવારની ઉજવણી કરવામાં આવનાર છે. જે સંદર્ભ જુલુસ સહીતના અન્ય કાર્યક્રમની ઉજવણી કરવાની મંજૂરી આપવા અંગે મળેલ રજુઆત સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા નીચે નિર્ણય લેવામાં આવેલ છે.

વાસ્તે, હું અજયકુમાર તોમર(આઇ.પી.એસ.) પોલીસ કમિશ્નર, સુરત શહેર, ફોજદારી કાર્યરીતી અધિનિયમ -૧૯૭૩ (૧૯૭૪ના નં.-૨)ની કલમ-૧૪૪ અન્વયે મને મળેલ સત્તાની રૂ એ નીચે મુજબ હુકમ કરું છું.

નોંધ:- આજ તા.૧૭/૧૦/૨૦૨૧ ના રોજ સરકારશ્રી દ્વારા ઇદ-એ-મિલાદના તહેવારના જુલુસ અંગે ગાઇડ લાઇન બહાર પાડવામાં આવતા ગઇ કાલ તા.૧૬/૧૦/૨૦૨૧ ના રોજ અત્રેની કચેરીના ક્રમાંક :એસ.બી./ ઇદ-એ-મિલાદ- /૧૯૩/૨૦૨૧ થી પ્રસિધ્ધ કરવામાં આવેલ જાહેરનામું રદ કરવામાં આવે છે.

:-:હુકમ :-

૧. ઇદ-એ-મિલાદ ના તહેવારની ઉજવણી દરમિયાન નિકળનાર જુલુસમાં મહત્તમ ૧૫ વ્યક્તિઓ અને એક જ વાહન સામેલ થઇ શકશે.
૨. ઇદ-એ-મિલાદના જુલુસનું આયોજન માત્ર દિવસ દરમિયાન જ કરી શકાશે.
૩. ઇદ-એ-મિલાદ નું જુલુસ જે વિસ્તારનું હોય તે વિસ્તારમાં જ ફરી શકશે અને શક્ય તેટલા ઓછા સમયમાં પૂર્ણ કરવાનું રહેશે.
૪. ઇદ-એ-મિલાદના જુલુસ અને અન્ય ઉજવણી દરમિયાન કોવિડ-૧૯ ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

--:વિસ્તાર:-

સુરત શહેર પોલીસ કમિશ્નરેટ હકુમત હેઠળનો સમગ્ર વિસ્તાર.

:: અમલવારીનો સમય ::

સુરત શહેર પોલીસ કમિશ્નર હકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં તા.૧૯/૧૦/૨૦૨૧ ના કલાક:૦૦/૦૦ થી તા.૧૯/૧૦/૨૦૨૧ ના કલાક:૨૪/૦૦ સુધી આ હકુમતનો અમલ કરવાનો રહેશે.

:શિક્ષા:-

આ હકુમતનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ફોજદારી અધિનિયમ સને-૧૮૬૦ ની કલમ ૧૮૮, ની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે.

-:જાહેર વિજ્ઞાપન:-

હું આથી આદેશ આપું છું કે, આ હકુમતની જાહેરાત ઉપર જણાવેલ વિસ્તારોમાં સહેલાઈથી દેખી શકાય તેવી જગ્યાઓએ તેની નકલ ચોંટાડી, લાઉડ સ્પીકર વાહન દ્વારા તેમજ સ્થાનિક વર્તમાન પત્રો, આકાશવાણી અને દૂરદર્શન કેન્દ્રો ઉપરથી પ્રસિધ્ધ કરાવવું.

આ હકુમત અન્વયે સુરત કમિશ્નરેટમાં ફરજ બજાવતા અનાર્મ આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર અને તેનાથી ઉપરના દરજ્જાના કોઇ પણ પોલીસ અધિકારીશ્રીઓને આ જાહેરનામાંનો ભંગ કરનાર ઇસમો સામે ભારતીય ફોજદારી અધિનિયમ સને-૧૮૬૦ ની કલમ ૧૮૮, મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

આજ તા. ૧૭/૧૦/૨૦૨૧ ના રોજ મારી સહી અને સિક્કા કરી આપેલ છે.



(અજયકુમાર તોમર)
પોલીસ કમિશ્નર,
સુરત શહેર.

પ્રતિ,

- (૧) અધિક પોલીસ કમિશ્નરશ્રી, સેક્ટર-૧,૨ તથા ટ્રાફિક એન્ડ કાઇમ સુરત શહેર.
- (૨) નાયબ પોલીસ કમિશ્નરશ્રી, તમામ, સુરત શહેર
- (૩) મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી, તમામ સુરત શહેર
- (૪) તમામ પો.સ્ટે./ શાખા ઇન્ચાર્જશ્રીઓ, સુરત શહેર.(નકલો ચોંટાડી લાઉડ સ્પીકર, વાહન ધ્વારા જાહેરાત કરાવવા સારું)
- (૫) કંટ્રોલ ઇન્ચાર્જશ્રી, સુરત શહેર (તમામ વર્તમાનપત્રો તથા ન્યુઝ ચેનલોને એક-એક નકલ આપવી).

સવિનય નકલ રવાના :-

- (૧) અધિક મુખ્ય સચિવશ્રી, ગૃહ વિભાગ, ગાંધીનગર.
- (૨) પોલીસ મહાનિદેશકશ્રી અને પોલીસ મહાનિરીક્ષકશ્રી, ગુ.રા., ગાંધીનગર.
- (૩) અધિક પોલીસ મહાનિદેશકશ્રી (ઈન્ટે.), ગુ.રા., ગાંધીનગર.
- (૪) પોલીસ કમિશ્નરશ્રી અમદાવાદ શહેર, રાજકોટ શહેર/વડોદરા શહેર.
- (૫) પોલીસ મહાનિરીક્ષકશ્રી સુરત રેન્જ, સુરત.
- (૬) કલેક્ટરશ્રી, સુરત શહેર.
- (૭) મ્યુનિસિપલ કમિશ્નરશ્રી, સુરત શહેર
- (૮) નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, (ઈન્ટે.) સુરત રીજીયન, સુરત
- (૯) પોલીસ અધિક્ષકશ્રી, સુરત રૂરલ.
- (૧૦) નિયામકશ્રી, માહિતી ખાતુ, ગુ.રા., ગાંધીનગર.
- (૧૧) જીલ્લા સરકારી વકીલશ્રી, સેસન્સ કોર્ટ, સુરત.
- (૧૨) મેનેજરશ્રી, ગર્વનમેન્ટ પ્રેસ વડોદરા, (ગેઝેટ ભાગ-૧ માં પ્રસિધ્ધ કરવા સારું).
- (૧૩) પો.ઈન્સ.શ્રી, સુરત રેલ્વે પો.સ્ટે.
- (૧૪) રજીસ્ટ્રારશ્રી, હાઈકોર્ટ, ગુ.રા., સોલા રોડ, અમદાવાદ.
- (૧૫) રજીસ્ટ્રારશ્રી, ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટ, સુરત .
- (૧૬) રજીસ્ટ્રારશ્રી, ચીફ જ્યુડીશ્યલ મેજી.શ્રી કોર્ટ, સુરત.
- (૧૭) વધારાના એકઝીક્યુટીવ મેજી.શ્રી, સુરત શહેર.(નાનપુરા બહુમાળી સુરત)
- (૧૮) સબ ડીવીઝનલ મેજી.શ્રી, સીટી પ્રાંત. (જીલ્લા સેવા સદન અઠવાલાઇન્સ સુરત
- (૧૯) સંયુક્ત માહિતી નિયામકશ્રી, સુરત (સ્થાનિક વર્તમાનપત્રો, આકાશવાણી તથા દૂરદર્શન કેન્દ્રમાં પ્રસિધ્ધ કરવા સારું.)